

મે 2, 2018

આ સપ્તાહના છેડે આપના શહેરને જેન્સ વોક ગાઈડેડ ટૂર્સ સહ ખૂંદો

બ્રેમ્પટન, ઓન્ટારિયો – જ્યારે સીટી ઓફ બ્રેમ્પટન આંતરરાષ્ટ્રીય જેન્સ વોક ફેસ્ટિવલની ઉજવણી કરશે ત્યારે નાગરિકોને મે 5, 6 અને 7 ના દિવસોમાં નિઃશુલ્ક માર્ગદર્શિત ચાલીને કરવાની સહેલમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવે છે.

જેન્સ વોકસ ચાલતા ચાલતા કરવામાં આવતા વાર્તાલાપો હોય છે, જ્યારે લોકોને પોતાના સમુદાયમાંથી નવા પાસાઓ મળી આવે ત્યારે તેઓને વાર્તાઓની આપલે કરવાની તક પૂરી પાડે છે, આ પ્રવૃત્તિ શહેરી આંદોલનકાર જેન જેકબ્સની યાદમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. **બ્રેમ્પટનમાં ચાર વોકસ થશે:**

માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ

તારીખ: શનિવાર, મે 5

સમય: બપોરે 1:30– બપોરે 2:30

સ્થાન: મળીશું બ્રેમ્પટન લાઈબ્રેરીના આગળના પ્રવેશદ્વાર પર, માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ સ્ક્વેર (100 કમ્પ્યુટર ડ્રાઈવ)

માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ એક પરિવહનલક્ષી શહેરી ગ્રામ છે જેનું બાંધકામ, આયોજન, અને રચના જેન જેકબ્સના ચાલી શકાય તેવા, મિશ્ર-ઉપયોગ ધરાવતી સંપૂર્ણ સમુદાયોના સિદ્ધાંતોને અનુસરે ચે. આ ટૂર ક્ષેત્રના ઈતિહાસ અને વારસા, કમ્યુનિટી અમેનિટી હબ, રહેઠાણ અને કમર્શિયલ વિકાસ અને સમુદાયના બાંધકામના અન્ય પાસાઓ તરફ નજરથી જોશે.

બ્રેમલી

તારીખ: રવિવાર, મે 6

સમય: સવારે 10 - બપોરે 12

સ્થાન: મળીશું ડિક્કિસ રોડ અને કિવન સ્ટ્રીટ ઈસ્ટ (સ્ટારબક્સની સામે)ના દક્ષિણપૂર્વ ખુણા પર

મધ્ય 20મી સદીમાં, બ્રેમલી પોતાના સેવા અને કમર્શિયલ સેંટરો સાથે કેનેડાના પ્રથમ સેટેલાઈટ શહેર તરીકે નાવિન્યપૂર્ણ કમ્યુનિટી ડિઝાઈનનું મોડેલ હતું. નવપ્રવર્તક તરીકેની પ્રોફાઈલને ચાલુ રાખવા બ્રેમ્પટન 2040 વિઝન બ્રેમલીને અદ્યતન કરવાનો પ્રસ્તાવ આપે છે, ખાસ કરીને જ્યારે વિષય પર્યાવરણીય સ્થિરતા અને ત્યાં કેટલું જીવવા યોગ્ય છે તેનો હોય. આ ટૂર બ્રેમલીના ઉન્નત ભૂતકાલીન ઈતિહાસ પર નજર કરશે અને તે વિષે વાત કરશે કે પાડોશના વિસ્તારના પુનરુત્થાન પછી તે કેવું જણાશે.

ડાઉનટાઉન બ્રેમ્પટન એતોબિકોક ક્રીક અને રિવરવોક

તારીખ: રવિવાર, મે 6

સમય: સાંજે 1 – 3

સ્થાન: મેઈન સ્ટ્રીટ સાઉથના ઉત્તરપશ્ચિમ ખૂણા અને વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ ખાતે મળીશું, જે સીટી હોલના દક્ષિણ તરફ, પાસે જ છે (2 વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ)

આ ટૂર નગરની સ્થાપનામાં એતોબિકોક ક્રીકની ઐતિહાસિક ભૂમિકા શૂં હતી તેમજ તેનો પૂરના ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ત્યાંથી, ચર્ચાપૂર ઘટાડવા માટેના ઉકેલ તરીકે કરવામાં આવતા હાલના કાર્ય વિષે થશે અને ડાઉનટાઉન કોરની વિકાસ સંભાવનાને સ્પષ્ટ કરશે. તે કરતી વખતે ટૂર વારસાની જાળવણી, સુધારાલક્ષી પુનઃઉપયોગ અને લાક્ષણિકતાના સુધારા દર્શાવશે.

કૃપા કરી નોંધી લેશો:

- આ ટૂરમાં પગથિયા અને મુશ્કેલ ઢાળવાળા ચઢાણોનો સમાવેશ થાય છે અને એના કેટલાક ભાગમાં શારીરિક મર્યાદાઓ ધરાવતા લોકો માટે પડકારરૂપ હોઈ શકે.
- પાર્કિંગની વ્યવસ્થા સીટી હોલ પર અને જ્યોર્જ સ્ટ્રીટ પર વેસ્ટ ટાવર ગેરેજિસમાં ઉપલબ્ધ છે. સપ્તાહના છેડે પાર્કિંગ મફત હોય છે.

શેરિડાન કોલેજ અને અપટાઉન બ્રેમ્પટન ટૂર

તારીખ: સોમવાર, મે 7

સમય: સવારે 09:30– બપોરે 11:30

સ્થાન: શેરિડાન કોલેજ ડેવિસ કેમ્પસ (7899 મકલાક્લિન રોડ) પર આવેલ “S” શિલ્પ પર મળીશું. શેરિડાન ખાતેના પાર્કિંગ વિષે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.sheridancollege.ca/life-at-sheridan/campus-services/parking/faqs

વિશ્વવિખ્યાત શહેરી સ્વપ્નદ્રષ્ટા લેરી બિસ્વીની દોરવણી હેઠળ, આ માહિતીસભર વોર્કિંગ ટૂર અને વાર્તાલાપ આપણા સમુદાયના તમામ વિભાગોમાં કાર્ય કરવાની પ્રેરણા પુરી પાડશે. તે શરૂ થશે શેરિડાન કોલેજના ડિસ્ટ્રિક્ટ એનર્જી પ્રોજેક્ટની ટૂરથી જેના બાદ તે વિસ્તારમાંથી સહેલ

કરાશે જેની બ્રેમ્પટન 2040 વિઝન "અપડાઉન બ્રેમ્પટન" તરીકે પુનઃકલ્પના કરે છે. ટૂંક બરાબર હુરોન્ટારિયો એન્ડ સ્ટીવ્સની બહાર સમાપ્ત થશે જે બ્રેમ્પટનના મહત્વના ચાર રસ્તા છે.

-30-

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

નેટલી સ્ટોગ્ડિલ (Natalie Stogdill)

મિડિયા સંકલનકર્તા (Media Coordinator)

સીટી ઓફ બ્રેમ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca